

12 ઊમૂર ન્યૂઝલેટર

સિલ્કે હયાત

ઊમૂર માલીયાહ

અંક 4 | શાબાન અલ કરીમ 1442 | ગુજરાતી



અઈમમત તાહેરીન ના ઝમાન ના
ફાતેમી સીકકા.

Photo Courtesy : Stephen Wakeham
Website : www.stephenwakeham.com

ફાતેમી સલ્તનતના હજાર વર્ષ પહેલાના સિક્કાઓ તેના બનાવનાર અઈમમત ફાતેમીયીન (અ.સ.) ની શાન અને શાહી પર દલાલત બતાવે છે. અઈમમત ફાતેમીયીન (અ.સ.) ખાસ કાળજી લેતા કે ફાતેમી સલ્તનતમાં બનેલા તમામ સિક્કાઓની ગુણવત્તા સારામાં સારી હોય, પણ અઈમમત ફાતેમીયીન (અ.સ.) ના બનાવેલા સોનાના દીનાર - બીજા દીનાર ને ટેસ્ટ કરવા માટે ઉપયોગ માં આવતા. ૨૪ કેરેટ ખરા સોનાનાં માધ્યમના દીનાર તેના અમાનવદારી અને ભરોસાની શિખામણ સમાવે છે. દરેક દીનાર પર થોક્કસ ડિઝાઇન અને અમાનના ઈમામનું નામ-ઝીણવટથી આયોજન કરવાની શિખામણ આપે છે, અઈમમત ફાતેમીયીન (અ.સ.)ના સિક્કાઓમાં ઉમૂર માલીયાહનાં ખિદમતગુઝારો માટે ઘણી શિકામણો સમાયેલી છે.

બેલેન્સ-જીવન શૈલી

લેખક- મુ. મોહમ્મદ યુસુફ ભાઈ ચીતલવાલા

તરાઝુ- સંતુલન આ શબ્દ એટલો વિશાળ છે કે તે આસમાન અને તારાઓની શ્રેણીને તેમાં સમાવી લે છે. આ સંતુલનનો પુરાવો આસમાનના ફરવામાં અને જમીન ઉપરના જીવોમાં નઝર આવી જાય છે. દા.ત. સુરજ જમીનથી એટલો જ દૂર છે કે જેને લીધે જમીન, ના તો સળગી ઉઠે કે ના તો થીજી જાય પરંતુ તે તમામ જીવોની હયાતીનું કારણ બની જાય છે. ખાટું પાણી, મીઠું પાણી, નહેર, માટી ઝાડપાન, પહાડ, રણ ખેતીની જમીન ઝાડો જાનવરો, પક્ષીઓ અને ઈન્સાન આ તમામનું એટલું સપ્રમાણમાં સંતુલન કીધું છે કે જેના લીધે જીવન માટેનું સંપૂર્ણ પર્યાવરણ બની શક્યું છે.

આ સંતુલનને " Balance of Nature" કહેવામાં આવે છે અને વિશ્વનું સંતુલન અને તેની અસરો ઈન્સાનમાં પણ નજર આવે છે. ઈન્સાનના શરીરમાં તમામ નાના મોટા અંગો ખુન, નસો, બલ્કે ઈન્સાનના નખોને એવી રીતે મુકવામાં આવ્યા છે કે ઈન્સાનને દુનિયાના તમામ જીવો ઉપર સર્વોપરિતા મળી છે. ખુદાતઆલાની ખિલકતમાં આ શાનનું અને સંપૂર્ણ સંતુલન જોઈને, તમામ વિશ્વ પોતાની ઝબાનસી એમ કહી દે છે કે -

ખુદાતઆલાની ખિલકતમાં આ શાનનું અને સંપૂર્ણ સંતુલન જોઈને, તમામ વિશ્વ પોતાની ઝબાનસી એમ કહી દે છે કે " ફ તબારકલ્લાહો આહસનુલ ખાલેકીન"

"ફ તબારકલ્લાહો આહસનુલ ખાલેકીન" આ રીતે ખુદાતઆલાની કાએનાતસી સંતુલન કેમ રાખવું એ બોધ લેવું એ દરેક અકલમંદની સમજદારી છે.

ઈન્સાની જિંદગીના દરેક પહેલુમાં સંતુલન આવી જાય તો તે વધુ સારી જિંદગી ગુઝારી શકે છે. સંતુલનનો મતલબ એમ છે કે જીવનના દરેક પહેલુમાં જે ચીજો જેમ કરવી જોઈએ, જેટલી કરવી જોઈએ તેમ થાય, ના ઓછુ ના વધારે. જેમ સંતુલન (ત્રાજવામાં) જો કોઈ પલ્લામાં ઓછુ યા વધારે થઈ જાય તો હિસાબમાં ફરક પડી જાય તેમ જો જિંદગીના કોઈ પણ બાજુએ સંતુલનમાં ફરક પડી જાય તો ઝીંદગીમાં તે હિસાબે ફરક નજર આવે છે.

ખુદાતઆલાયે અને અવલીયાઉલ્લાહ (સ.અ.) યે જિંદગીના વિભિન્ન (અલગ-અલગ) બાજુઓમાં સંતુલન રાખવા બાબતે ઘણી હિદાયતો ઈનાયત ફઝલ ફરમાવી છે. ઈબ્રાહુલ્લાહની ચીહન (તારીફ) કરતા હુઆ કુરઆને મજીદ યે એમ અદા કીધું છે કે તેઓ ખર્ચ કરે છે તો ફુઝુલ ખર્ચ પણ નથી કરતાં અને કંજુસી પણ નથી કરતાં. તે બેવેના દરમ્યાન સંતુલન રાખે છે. રસૂલલ્લાહ (સ.અ.વ.) યે ફરમાયું છે તમે તમારા દિવસને ત્રણ હિસ્સામાં વિભાજીત કરો. એક હિસ્સો ખુદાની ઈબાદતમાં એક હિસ્સો રોઝી કમાવામાં અને એક હિસ્સો હવાલની લઝઝત લેવામાં વિભાજીત કરો. એજ રીતે એમ બયાન આવ્યું છે કે જો લોકો પોતાના જમન મા બેલેન્સ કરે, તો બદા ના શરીર સ્વસ્થ રહે. આ રીતે માલ સમય અને જમણની જેમ દરેક બાબતોમાં સંતુલન રાખવું. જીવન જીવવાનો ખરો તરીકો છે.

જેમ ઈન્સાનના શરીરમાં ખુદાતઆલાયે Blood Circulation મુફ છે. જેના લીધે ઈન્સાનના શરીરનું સંતુલન રહે છે. તે રીતે ઈન્સાનના જીવનમાં માલ Blood Circulation નો રોલ અદા કરે છે. અગર જો આ Circulation - એટલે કે માલનો હિસાબ બરાબર હોઈ તો ઈન્સાનની જિંદગીના અકસર પહેલું મા સંતુલન આવી જ જાય છે. તેથી એમ સમજવું જરૂરી છે કે Budgeting કરીને હિસાબ કિતાબ રાખીને Blood Circulation ને કઈ રીતે વધુ સારામા સારી રીતે રાખી શકાય.

માલના ત્રાજવામાં સંતુલન રાખવું એટલે એમ છે કે આવક અને જાવકના બને પલ્લુ બરાબર સ્થીર હોઈ કોઈ એક પલ્લુ ઘણું નીચે થઈ જાય તો Circulation માં ફરક પડી જાય અને સંતુલન બગડી જાય. અદદાઈ અલ અજલ સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન (રી.અ.) એ ફરમાવ્યું છે કે લોકો 3 પ્રકારના હોઈ છે એક ઘણા મહમુદ, બીજા મહમુદ અને ત્રીજા મઝમુમ

- ઘણા મહમુદ એકલે જે એક રૂપિયો કમાઈ અને 12 આના ખર્ચી દે અને ચાર આના બાકી રાખે.

દરેક વ્યક્તિને બજેટ બનાવવાની આવડત આવી જાય તો દરેક વ્યક્તિનું Blood Circulation મજબુત થઈ જાય અને સઘલાના જીવનમાં સંતુલન (Balance) આવી જાય

- મહમુદ એ કે જે આવે તે ખર્ચી દે.

- મઝમુમ એ કે જે આવક હોય તેના કરતા વધારે ખર્ચી દે. આજે ચઢતી છે તો દેવું કરી દીધું. ના! આવક જેટલા હોય એટલું જ ખર્ચો. આપણે સંતુલનને કાયમ રાખવા માટે નિયમોને ઈનાયત ફરમાવી દીધા છે.

બિલાદ ઈમાનીયાહ મા સંતુલનને કાયમ રાખવાની જવાબદારી લેવા માટે મોલાનલ મિન્આમ (ત.ઉ.શ.) યે ઉમુર માલીયાની સ્થાપના કરી છે. જે ઉમુર માલીયાના ખિદમતગુઝારો હિસાબ કિતાબ રાખી Budgeting કરે છે. એટલું જ નહિ પણ તેના સાથે ઘણી બાબતોમાં ખૂબી સી સંતુલન કાયમ રાખે છે. આ સંતુલનને કાયમ રાખવા માટે બજેટ કેટલું જરૂરી છે તે ઉમુર માલીયાના દરેક ખિદમત ગુઝાર બલ્કે માલથી લેવડદેવડ કરનાર દરેક વ્યક્તિને બબર છે. જેમ ગામો મા ઉમુર માલીયાના ખિદમતગુઝારો કરે છે તે પ્રમાણે દરેક વ્યક્તિને બજેટ બનાવવાની આવડત આવી જાય તો દરેક વ્યક્તિનું Blood Circulation મજબુત થઈ જાય અને સઘલાના જીવનમાં સંતુલન (Balance) આવી જાય અને એ સઘલાનું મિઝાન (ત્રાજવું) બરાબર થઈ જાય જે મૌલનલ મન્આમ (ત.ઉ.શ.)ની ઉમ્મીદ પણ છે અને કોશીશ પણ છે.

આ બધી વસ્તુને આલીકદર મુફદલ મૌલાએ (ત.ઉ.શ.) ઉમુર માલીયાના હેઠળ આવરી લીધું અને એમ ફરમાયું કે ઉમુર માલીયા જમાઅતનો હિસાબ અને તેનું Budget ઝમાનના હાલાત મુતાબીક અને કાનુની પાલન સાથે હોય, મુમેનીન પોતાના ઘરનું બજેટ પણ બરાબર બનાવે અને આ 12 ઉમુરના હિસાબે દરેક ગામની તરક્કી માટે યોગ્ય બજેટ બને.

આલમે ઈમાન થી ઊમૂર માલીયાહ ની ઝલક

બજટીંગ સેમીનાર શારેકા

શારેકામાં દાઅેરતુલ અકીકના મેમ્બરોએ Home Budget માટે જાગૃતિ પ્રોગ્રામ કર્યો. ઘણા બહેનોને ITS ઉપર હોમ બજેટના Template ની જાણકારી નહોતી તે બાબતે જાણકારી આપી જેથી ઘરની આવક અને ખર્ચની બરાબર રીતે નોંધ કરે.

ઘરેલૂ બજટ નો મહત્વ રાવલ પિંડી

રાવલપિંડી માં મુમેનાત બહેનો માટે Household Budgeting માટેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. તેમાં 90 ટકા મુમેનાત બહેનોએ ભાગ લીધો એક બહેનએ એમ કહ્યું કે આજના આવા બુરા હાલાતમાં ઝમાનમાં Budgeting અપની સોયથી એકદમ નીકળી ગયું હતું. પરંતુ આ પ્રોગ્રામથી એમ સમજાયું કે Budgeting કરવાની જરૂરત છે.

ખૂબીદાર રીતે બજટિંગ કોલંબો

કોલંબોમાં મુમેનાત બહેનોએ House Hold બજેટીંગના પ્રોગ્રામમાં મોબાઇલ ચોક્કસ કઈ રીતે વાપરવું એ શિખાડવામાં આવ્યું જે ઘણું જ સહેલ છે અને તેમાં ખર્ચને સહેલાઈથી નોંધ કરી શકાય છે. "user friendliness" ના લીધે બધા બહેનોએ તે App વાપરવું શરૂ કરી દીધું.

અમારા વાયકો તરફથી એક શબ્દ

"મારા બાવાજી હંમેશા સલાહ આપતા કે તમે જે ખર્ચ આખા દિવસમાં કર્યો હોય તેની નોંધ તમારી ડાયરીમાં કરો. આ પ્રોગ્રામથી યાદ રહી ગયું કે રકમની નોંધ તો હોવી જ જોઈએ. કે જેથી બીજીવાર બરાબર પ્લાનીંગ કરી શકાય. આમ કરીને હું ખેરના કામો જેમકે ફેઝમાં, કર્જન હસનાહમાં શામીલ થઈ શકું.

-ઝીનતબહેન મુ. કુત્બુદ્દીન

બજટિંગ ની ગાઈડબુક- લાકીમતી હદયો

"અદાઈ અલ અજલ સૈયદના આલિકદર મુફદ્લ સૈફુદ્દીન (ત. ઉ. શ.) મૌલાએ મમલુકે સૈયદના (ત.ઉ.શ.) ના ઘરે બેંગલોરમાં ઝિયાફતનું અઝીમ શરફ ઇનાયત કીધું, તેમાં આપ મૌલાએ મમલુકે સૈયદના (ત.ઉ.શ.)ને ઘરગથ્થું અંદાજપત્ર (Household Budget Manual)ની કિતાબ ઇનાયત કીધી. આ કિતાબમાં બજેટ બનાવવા બાબત ઘણા મહત્વના મુદ્દાઓ આપવામાં આવ્યા છે, લગભગ બધાને જાણકારી હોય જ છે કે બજેટ બનાવવું જોઈએ પણ આ કિતાબમાં 6 ઉમૂર જેના મુતાબિક બજેટ બનાવવું જોઈએ તે ઝીકર કરવામાં આવી છે. મમલુકે સૈયદના (ત.ઉ.શ.)ને આ ગાઈડલાઇન્સ પ્રમાણે બજેટ બનાવવાથી ઘણો ફાયદો થયો છે. અને ખાસ આ કોરોનાના સમયગાળામાં ખર્ચાઓની ગોઠવણી કરવાથી બેહમિલ્લાહ અર્થવ્યવસ્થિત અસર ના પડ્યો.

-મુલ્લા અબ્બાસભાઈ સૈફી - બેંગલોર




Household Budgeting Manual

આલમે ઈમાન થી ઊમૂર માલીયાહ ની ઝલક

બજટિંગ થી થી જમાત ના ફાઈદાઓ

શેખ મોહમમદ ભાઈ પૂનાવાલા. સીગતુલ અમાલત (મુંબઈ)



"અપના અવલીયા ઉલ્લાહ હંમેશા માલના બારામાં તકેદારી રાખી અને લોકોને પણ એવી જ રીતે શિખામણ આપી. મૌલાના અલી (સ.અ.)યે એક દિનાર માટે જાબીરને કુફાથી મદિના મોકલા. સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન આકા (રી.અ.)યે દુકાળ સમયે અગીયાર હજાર મુમેનીનને સુરત બોલાવ્યા અને તેઓને આસરો આપો. બધાને હુનર શિખાયું અને પાછા પોતાના ગામ તર વ્યા ત્યારે બધાને પોતાની મહેનતની કમાઈ હિસાબથી રકમો આપી. આજે સૈયદના આલી કદર મુફદ્લ મૌલા (ત.ઉ.શ.) જમાતના હિસાબ કિતાબ માટે ઘણી તકેદારી રાખવા કહે છે અને Budgeting બાબતે ઘણું ફરમાવે છે.

દરેક જગ્યાની જમાત વાર્ષિક budget તૈયાર કરે છે અને અલવજારતમાં અરજ કરે છે અને

Accountants યે budget ને બરાબર જોઈ ચકાસણી કરે છે તે પછી બધી જમાતના budget હુઝુરે આલામાં પેશ કરવામાં આવે છે અને મૌલા મનઆમ યે મુતાબીક ખર્ચ કરવાની રજા આપે છે અને જમાત ખર્ચ કરે છે. આ રીતે મૌલાની રજા મુબારક એક બરકતનું સબબ બને છે.

Budget બનાવતી વખતે બધી જગ્યાના વાર્ષિક goals, Construction ના કામો, Administrative કામો વગેરે સામને આવી જાય છે અને તેનાથી યે સાલમાં ક્યા કાર્યો અંજામ થાસે એહનું Planning થઈ જાય છે. મૌલા જે ઈરશાદ ફરમાવે યે મુતાબીક 12 ઉમૂરમાંથી દરેકના goals set કરાય અને એજ મુતાબીક Budget તૈયાર થાય અને 12 ઉમૂરના કામો અને તરક્કી થાતી જાય. અને છેવટે આખા ઈલાકાની તરક્કી થાય. "

મોઝે મા ઊમૂર માલીયાહ નો અસર

મુ. મુરતઝા ભાઈ શેખ ઝોહેર ભાઈ શાકીર, આમીલ સાહેબ. (દીલ્લી)



"ઉમૂર માલીયાના અલગ અલગ કામોમાંથી એક main Function વાત કરું છું.

સૈયદી અબ્દુલકાદીર હકીમુદ્દીન (ક.રુ.)ની સબીલુલખૈરની રસમના ઝરીયાથી મુમેનીન કંઈક ખૈરના કામોમાં શામિલ થઈ જાય છે. હમારા મોઝેમાં એમ તદબીર કીધી કે હજ, ઉમરાહ, કરબલા નાઅબુદાત, આશુરા વગેરે ખૈરના કામમાં સબીલુલ ખૈર વલ બરકતના ઝરીયાથી થાય. પહેલા આ અલગ કામ માટે અલગથી રકમ લેવામાં આવતી હતી હવે સબીલુલ ખૈર થી જ બધુ થાય છે.

મુમેનીન પોતાના Payment history જોઈ

શકે છે અને પ્રીટ ભી લઈ શકે છે આ રીતે implement કરવાથી મુમેનીનનું એક અનોખું Positive approach દેખાય છે. અને લોકો ખુશ થઈને સબીલુલ ખૈર બરકતમાં શામિલ થાય છે.

એમ દેખાય છે કે મોઝેમાં ઉમૂર માલીયને બહેતર તરીકાથી અમલ કરવાથી.

- મુમેનીનનો ભરોસો મળે છે.


- મુમેનીન ખુશ થાય છે એ લોકોના માલ સહી જગા પર સહી રીતે વપરાય છે.

- જમાતને પુરા વર્ષની આવક જાવકનો overview મળી જાય છે."

જમાઅતનું બજેટ કેવી રીતે તૈયાર થાય છે?

મૌલનલ મીનઆમ (ત.ઉ.શ.) ઉમુર માલિયાહની હદને નક્કી કરતાં ફરમાવે છે. "જમાઅતનો હિસાબ અને એહનું બજેટ ઝમાનનાં મુક્તદા મુતાબિક અને કાનૂનની મુરાઅતનાં સાથે હોય."

જમાઅતનું બજેટ તૈયાર કરવું એક મહત્વપૂર્ણ કાર્ય છે જેના કારણે હાલનાં સમય પ્રમાણે મુમેનિનની ઉન્નતિ માટે આર્થિક આયોજન કરવું સરળ બને છે. જમાઅતનું બજેટ કેવી રીતે બને છે તે સમજવા માટે નીચે થોડાં મુદ્દાઓ આપવામાં આવ્યા છે:-



પૂરા વર્ષ માટે લક્ષ્ય

પૂરા વર્ષ માટે લક્ષ્ય અને પ્રથમિકતાઓ ને નક્કી કરવામાં આવે છે. જમાઅત અને 12 ઉમુરની કમિટી આવતા વર્ષનાં 12 ઉમુરના તમામ આપસુઝ માટે હિસેમ્બરમાં આયોજન કરે છે અને દરેક લક્ષ્યોનું દસ્તાવેજીકરણ કરે છે.

1



દરેક લક્ષ્ય માટે આયોજન

12 ઉમુર માંથી દરેક કમિટી પૂરા વર્ષમાં જે પહેલ લેશે તેની મૂડી માટે માદકોબજેટ તૈયાર કરે છે.

2



સંયુક્ત બજેટ

ઉમુર માલિયાહ કમિટી બધા ઉમુરનાં લક્ષ્યો અને માદકોબજેટને ધ્યાનમાં રાખીને સંયુક્ત બજેટ તૈયાર કરે છે. ગામની પ્રાથમિકતાનાં હિસાબે તે બજેટ બાબત ચર્ચાઓ થાય છે અને અંતિમ રૂપ આપવામાં આવે છે.

3



બજેટ નું ઓડિટ


બજેટ તૈયાર થયા પછી - તે અલવઝારતૂસ સેફીયાહ અલમોઅઝઝમાહ (અ.બ.) માં અરઝ કરવામાં આવે છે, જ્યાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ તેના આકડાઓમાં નઝર કરે છે અને બજેટમાં કોઈ પણ ફેરફારની જરૂર હોય તો તેમાં મદદ કરે છે.

4

રઝા અને દુઆ માટે અરઝ

બજેટ નું વર્ગીકરણ તમામ બજેટ અને પ્રોજેક્ટ્સ - અલસાદાતુલ અજલાઉલ કિરામમાં મંજૂરી માટે અરઝ થાય છે, અને તે પછી હઝરત આલિયાહમાં રઝા મુબારક માટે અરઝ થાય છે. ગયા વર્ષે હિન્દુસ્તાનનાં લગભગ 340 ગામોએ પોતાના બજેટનું પ્લાન રજૂ કર્યો જેનો રિપોર્ટ હઝરત આલિયાહમાં મંજૂરી અને દુઆ મુબારક માટે અરઝ થયો.

5



ACTIVITY OF THE MONTH - બજટિંગ એક્ટીવીટી

સૈદના મોહમમદ બુરહાનુદીન (ર.અ) ફરમાવે છે-
તમારા દર ના ખરચા ને બરાબર બેલેંસ કરો. આમદ
કરતા ખરચ ને વધાવો ના. સગલા ને પોતાની આમદ ના
હિસાબે બજટ બનાવૂ જોવે.

તમારી આમદ અને ખરચ વચચે બેલેંસ કરવા
બજટિંગ એપ સી ફાઈદો લો. એપ ડાઉનલોડ
કરવા નીચેની લિંક પર કલિક કરો.



ખિલકત ની સિખામન

"કુરાન મજીદ એ અકલમંદ લોકોની
ઝીકરમાં એમ અદા કીધું છે કે તે બધા
ખુદા તઆવાની ખલકતમાં
તફકકુર(ચિંતન) કરે છે, ખુદા તઆવાની
ખલકતમાં તફકકુર(ચિંતન) કરવાથી
ઝીદગી વિતાવવા બાબત ઘણી
શીખામણ મળી જાય છે.

જેમ કે કીડીથી આયોજન શીખી શકાય
છે, કીડીના કાર્યમાં એમ જોવાય છે કે તે,
- પોતાની સુરક્ષા માટે ઘરને જમીનનાં
અંદર બનાવે છે.


- ઠંડીની મોસમ માટે ગરમીની મોસમમાં
જ દાણા અને ખોરાક ભેગો કરી લે છે.

- દાણાઓને બે ટુકડામાં તોડી દે છે
એટલે તે ઊગી ના જાય.

- પોતાના ઘરને હવા અને પાણીથી
સુરક્ષિત રાખવા માટે ઊંચું કરી દઈ છે.

ખુદા તઆવાની ખિલકત આપણે
આયોજનની શિખામણ આપે છે."

અવલિયાઊલલાહ ની હિદાયત



તદબીર (પલેનીંગ) કરવૂ તેજ
અરદી ઝીદગી છે.

